



સાન ફ્રાંસિસ્કો સિટી અને કાઉન્ટી
ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થ
પર્યાવરણીય સ્વાસ્થ્ય વિભાગ



1390 Market Street, Suite 210
San Francisco, CA 94102

મુખ્ય: (415) 252-3800

ફેક્સ: (415) 252-3842

www.sfdph.org/dph/EH/Housing/BedBugs.asp

સુધારેલ: જાન્યુઆરી, 2013/ J.O.



SRO હોટેલ મેનેજર્સ માટે માંકડ નિયંત્રણ માર્ગદર્શિકા



સાન ફ્રાંસિસ્કો સિટી અને કાઉન્ટી

ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થ

Environmental Health Services
1390 Market Street, Suite 210
San Francisco, CA 94102

માંકડ શું છે?

માંકડ એ સૂક્ષ્મ જંતુઓ છે જે માનવો, પાલતુ પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના લોહી પર નભે છે. માંકડ પરોપજીવી છે. પુખ્ત માંકડ ¼” લાંબા (ઈંચનો ચોથો ભાગ). તેમને પાંખો હોતી નથી અને ઉડતા નથી. ખોરાક ખાતાં પહેલાં (લોહીનું ભોજન) તેમના શરીર ચપટાં હોય છે અને ત્યારબાદ ગોળ થઈ જાય છે. નવા જન્મેલા માંકડને "નિમ્ફ" કહે છે અને તેમના ઝીણાં, સફેદ શરીર નરી આંખે ન જોઈ શકાય તેવા નાના હોય છે.

દેખાવ



ચટાઈમાં આશ્રય લેતાં માંકડ



પુખ્ત માંકડ

મારા ભાડૂતને ત્યાં માંકડ છે તે હું કેવી રીતે જાણું?

માંકડ કરડવાના સ્થાને ખંજવાળ સાથે સોળ ઉઠે છે. આપ કે આપના ભાડૂઆતો ચદાઈ, ચાદર કે ઓશિકાના કવર પર જીવતા કે મરેલા માંકડ, લોહી કે મળના ડાઘા જોઈ શકો છો.

માંકડ ઈમારતોમાં કઈ રીતે ધૂસે છે?

જ્યારે લોકો પોતે અથવા સામાન, કપડાં, ફર્નિચર કે બેડિંગ જેવી તેમની વસ્તુઓ એવા વિસ્તારનાં સંસર્ગમાં આવે જ્યાં માંકડની હાજરી હોય તો માંકડ એક સ્થળેથી બીજા સ્થળે વહન પામે છે. રસ્તા પર પડેલી ચીજ કે અજાણ્યા સ્ત્રોતની વપરાયેલી ચીજો જેમ કે વપરાયેલ ફર્નિચર કે વપરાયેલાં કપડાં જેવી વસ્તુઓ ભેગી કરવામાંથી પણ માંકડ આવી શકે છે.

અટકાવ: હું મારી ઈમારતમાંથી માંકડ કઈ રીતે દૂર કરી શકું?

1. ભાડૂતોની બધી ફરિયાદોનો 48 કલાકની અંદર તાત્કાલિક પ્રતિસાદ આપો.
2. માંકડ ધરાવતા બધા રૂમ અને સામાન્ય વિસ્તારોનું નિરીક્ષણ કરવા, ઓળખવા અને તેનો ઉપચાર કરવા માટે લાયસન્સ ધરાવતા પેસ્ટ કંટ્રોલ ઓપરેટર સાથે પરામર્શ કરો.
3. ખાતરી કરો કે બધા ભાડૂતો માંકડની સારવાર માટે તેમના રૂમ તૈયાર કરે. (માંકડના અટકાવ માટે ભાડૂતની માર્ગદર્શિકામાં ઘોવા માટેની સૂચનાઓ જુઓ # 3-6).
4. દીવાલ, બેઝબોર્ડ, બારીના સિલ, ખાટલાની ફેમ, બોક્સ સ્પ્રિંગ, ક્લોસેટ, ફર્નિચર વગેરેમાં બધી તિરાડ અને તડનો ઉપચાર કરો અને બધી તિરાડ/તડને ભરી દો.

5. બધી ફાટેલી ચટાઈઓ અને બોક્સ સ્પ્રિંગ બદલો.
6. બધી પ્રદૂષિત ચીજો અને ચટાઈઓને ફેંકી દેતા પહેલાં તેનો ઉપચાર કરો.
7. માંકડના નવા ચિહ્નો ન મળે ત્યાં સુધી દર બે અઠવાડિયે સારવાર પૂરી પાડો.
8. પ્રત્યેક ઉપચાર બાદ બધા મરેલા માંકડને વેક્યુમ કરો અને ત્યારબાદ તરત પ્લાસ્ટિકની બેગની અંદર વેક્યુમ બેગ સીલ કરો અને તેને બહાર કચરાપેટીમાં ફેંકી દો.
9. અસરગ્રસ્ત રૂમમાંથી બધી ચીજો દૂર કરતાં પહેલાં પ્લાસ્ટિક બેગમાં સંપૂર્ણપણે સીલ કરો.
10. પ્લાસ્ટિક બેગ્સ. માંકડના ઉપચાર દરમિયાન ભાડૂતોને પ્લાસ્ટિક બેગ્સ આપો.
11. ઝલ્યુ બોર્ડ. માંકડ પર નજર રાખવા માટે આપના પેસ્ટ કંટ્રોલ ઓપરેટરને પલંગ નીચે તથા રૂમનાં ખૂણાઓમાં ઝલ્યુ બોર્ડ લગાડી આપવા માટે કહો.

વધુ સહાયતા માટે નીચેના નંબર પર ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થનો સંપર્ક કરો:

મુખ્ય: (415) 252-3800